

TIAAN CONSUMER LIMITED

CIN: L85100GJ1992PLC017397

Regd Office: [405, Patel Ahwamegh Complex, Jetalpur Road, Near Dairy Den Circle, Sayajigunj, Vadodara, Gujarat-390005](#)

Corp Office: [J-71, Lower Ground Floor, J- Block, Paryavaran Complex, IGNOU Road, Neb Sarai, New Delhi-110062](#)
[Email: tiaanconsumerltd112@gmail.com](mailto:tiaanconsumerltd112@gmail.com), [Mobile No.:- 8294697644](#)

Date: 15.02.2025

To,

The Manager
Department of Corporate Service
BSE Limited
P.J. Towers Dalal Street, Mumbai - 400001

SCRIP CODE: 540108 (TIAAN CONSUMER LIMITED) EQ - ISIN - INE864T01011.

Subject: Submission of Extract of Newspaper Publication of Un-audited Financial Results for the quarter ended on December 31st, 2024.

Dear Sir/Madam,

With reference to the above captioned subject, please find herewith enclosed copies of Newspaper Publication of Un-audited Financial Results for the quarter ended on December 31st, 2024. Pursuant to Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015.

The Financial Results was published in one English Newspaper “**English Daily Republic India**” and in one Hindi Newspaper “**Hindi Daily Samachar Today**” in the language of the region where the registered office situated. The web link for the direct access to the abovementioned newspaper advertisement is <https://www.republicbharat.com/> and <https://www.republicbharat.com/> You are requested to take the above on your records and acknowledge the same.

You are requested to take the above on your records and acknowledge the same.

Thanking You.

**For and on behalf of Board of Directors
TIAAN CONSUMER LIMITED**

Ajay Kumar
(Additional Director)
DIN: 07015936

Place: New Delhi
Encl: As above

ધો.10-12ની પરીક્ષાનું કાઉન્ટ-ડાઉન શરૂ

બોર્ડ દ્વારા રાજકોટ સહિત રાજયના કલેક્ટરો સાથે યોજાશે વીડીયો કોન્ફરન્સ

પરીક્ષા સમિતીની બેઠક બાદ રાજકોટ શહેર-જિલ્લાનો જાહેર થશે એકશન પ્લાન: તા.23ના પેપરો આવશે: રાજયમાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે કસોટી

રાજકોટ તા.14 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.27ને ગુરુવારથી ધો.10 અને 12ની પરીક્ષા શરૂ થનાર છે. જેને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાત બોર્ડની આ પરીક્ષા સુચારૂ રૂપથી લેવાય તે માટે શિક્ષણ બોર્ડના સચીવ દ્વારા



આગામી તા.19ને બુધવારના સવારના 11 કલાકે રાજકોટ સહિત રાજયભરના જિલ્લા કલેક્ટરો સાથે વીડીયો કોન્ફરન્સ આયોજીત કરવામાં આવી છે.

ઈન્યાર્જ જીલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમાર દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો એકશન પ્લાન જાહેર કરી દેવામાં આવનાર છે.

ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષામાં રાજકોટ શહેર-જીલ્લામાં 78 હજારથી વધુ વિદ્યાર્થીઓ બેસનાર છે જેમાં ધો.10ના 47280 ધો.12 સામાન્ય પ્રવાહના 23370 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહના 7780 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજયમાં ધો.10 અને 12ના 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ 1661 કેન્દ્રો પરથી આ પરીક્ષા આપનાર છે.

આ વખતે રાજયમાં 27 જેટલા પરીક્ષા કેન્દ્રોનો વધારો થયો છે.. રાજકોટ ખાતે બોર્ડની આ પરીક્ષાના પેપરો તા.23ના રાજકોટ ખાતે આવી પહોંચનાર છે.

આજથી રાજકોટ સહિત દેશભરમાં CBSE બોર્ડની

પરીક્ષાનો થશે પ્રારંભ: 44 લાખ વિદ્યાર્થીઓ

રાજકોટ,તા.14 સી.બી.એસ.ઈ.(CBSE)દ્વારા આવતી કાલ તા.15થી રાજકોટ સહિત દેશભરમાં ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. સમગ્ર દેશમાં 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર હોય આ પરીક્ષા શાંતીપૂર્ણ વાતાવરણમાં લેવા માટે બોર્ડ સજ્જ બની ગયેલ છે.રાજકોટ રીજ્યનમાં 4 હજારથી વધુ વિદ્યાર્થીઓ 48 જેટલા કેન્દ્રો

પરથી આ પરીક્ષા આપનાર છે. કેન્દ્રીય શિક્ષા બોર્ડ દ્વારા આ વખતથી તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી ફરજિયાત કરી દેવામાં આવેલ છે. જેનું રેકોર્ડીંગ હવે કેન્દ્ર સંચાલકોએ ફરજિયાત સાંચવી રાખવું પડશે.આ માટે મોનીટરીંગ ઓફીસરની નિયુકિત કરી ખાસ ફરજ સાંપી દેવામાં આવી છે.સી. બી.એસ.ઈ બોર્ડની આવતીકાલથી શરૂ થનારી પરીક્ષા તા.4 એપ્રિલ આવશે.

સુધી ચાલશે જેમાં આવતીકાલે તા.15ને શનિવારે સવારના સેશનમાં 10.30 થી 1.30 કલાક દરમિયાન પ્રથમ ઈંગ્લીશનું પેપર લેવામાં આવનાર છે.આ પરીક્ષાનો પ્રારંભ થતા જ સી.બી.એસ.ઈનો અભ્યાસક્રમ ચલાવતી શાળાઓમાં પરીક્ષા ફીવર છવાઈ જશે આ પરીક્ષા પર દિલ્હી સ્થિત કન્ટ્રોલ રૂમ દ્વારા પણ બાજ નજર રાખવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર શાંત રવિવારે જુનાગઢ કોર્પો.- 30 પાલિકામાં મતદાન

બે હજારથી વધુ ઉમેદવારોના રાજકીય ભાવીનો થશે ફેસલો

રાજકોટ, તા. 14 રાજકોટ જિલ્લાની પાંચ સહિત સૌરાષ્ટ્રની 30 પાલિકાની ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન શરૂ થવા પામેલ છે. તા.16ને રવિવારે યોજાનારી આ ચૂંટણીમાં પ્રચાર આજે સાંજથી શાંત થઈ જશે.

સૌરાષ્ટ્રમાં જુનાગઢ મ્યુ. કોર્પો. સહિત 30 પાલિકાની આ ચૂંટણીમાં ૨0૫1 જેટલા મતદારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આવતીકાલે બપોર સુધીમાં ચૂંટણી સ્ટાફ મતદાન મથકોનો કબ્જો સંભાળી લેનાર છે. મતદાન બુથોમાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે.

પાલિકાની આ ચૂંટણીમાં બેઠકો કબ્જે કરવા માટે ઉમેદવારોએ એડીસીટીનું જોર લગાવી દીધુ હોય રાજકીય ગરમાવો આવી જવા પામેલ છે. કેટલીક જગ્યાએ બળવાખોરોએ પણ માથુ ઉચકયુ છે. જોકે મતદારોમાં નિરસતા હજુ વ્યાપેલ છે. આજે સાંજથી પ્રચાર પ્રદર્શન શાંત થયા બાદ મતદારો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે.

રાજકોટ જિલ્લામાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાવાવધર અને ઉપલેટા એમ ચઈને કુલ પાંચ નગરપાલિકાની તથા ગાંંધ, ઉપલેટા, જેતપુર અને જસદણ ચઈને કુલ 6 તાલુકા ઇન્ચાયતની બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, પાંચ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. તેમાં જસદણ નગરપાલિકા 1 થી 7 વોર્ડ માટેની ૨8 બેઠકો પર 64 ઉમેદવારોએ ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે, જેમાંથી બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેતપુર-નવાગઢ નગરપાલિકામાં 1 થી 11 વોર્ડ માટેની 44 બેઠકો પર 140 ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે. ધોરાજી નગરપાલિકામાં 1 થી 9 વોર્ડ માટેની 36 બેઠકો પર 110 ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે.

ભાવાવધર નગરપાલિકામાં 1 થી 6 વોર્ડ માટેની ૨4 બેઠકો પર 68 ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે. ઉપલેટા નગરપાલિકામાં 1 થી 9 વોર્ડ માટેની 36 બેઠકો પર 87 ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે. જેમાંથી પાંચ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. પાંચ નગરપાલિકાની ચૂંટણીઓમાં કુલ 168 બેઠકો પર કુલ 469 ઉમેદવારોએ નામાંકન કર્યું છે અત્યાર સુધીમાં કુલ સાત બેઠકો બિનહરીફ જાહેર કરાઈ છે.નગરપાલિકાની ચૂંટણીઓની સાથોસાથ તાલુકા પંચાયતની કુલ 6 બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ યોજાનાર છે. ગાંંડલની એક બેઠક, ઉપલેટાની બે બેઠક, જેતપુરની એક બેઠક અને જસદણની બે બેઠક ચઈને કુલ 6 બેઠક પર કુલ 1૨ ઉમેદવારોએ નામાંકન કર્યું

છે.નગરપાલિકાની અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે યોજાય તે માટે રાજકોટ વહીવટી તંત્રના 4110 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સમગ્ર ચૂંટણીની વિવિધ કામગીરી માટે કુલ 11 નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હેલ્પલાઈન તથા ફરિયાદ માટે 0281-2471573 નંબર નક્કી કરવામાં આવ્યો છે.તમામ બુથ ઉપર ચૂંટણી ફરજના સ્ટાફ માટે પીવાનું પાણી, ભોજન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

નગરપાલીકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે કુલ પાંચ સપ્તી મતદાન મથકો નિયત કરવામાં આવ્યા છે. મત ગણતરી તા. 18/02/2025ના રોજ સવારે 9 કલાકથી ચૂંટણી મત ગણતરી કરવામાં આવશે.નગરપાલિકા તથા તાલુકા પંચાયત માટે રીસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટરો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જે મુજબ ધોરાજી નગરપાલિકાનું રીસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર, નવી ભગતસિંહજી હાઈસ્કુલ ધોરાજી રહેશે. જેતપુર-નવાગઢ નગરપાલિકાનું રીસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર સેન્ટ ફાન્સીસ સ્કુલ નેશનલ હાઈવે નવાગઢ જેતપુર રહેશે.ઉપલેટા નગરપાલિકાનું રિસિવિંગ અને ડિસ્પેચીંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર ટાવરવાળી તાલુકા શાળા, ઉપલેટા ખાતે રહેશે.

સામાન્ય વ્યક્તિની જેમ

કાફેમાં કોફી પીધી

અમદાવાદ તા.14

ગુજરાત હાઈકોર્ટ ખાતે આજે એક વિરલ ઘટના બની હતી જેમાં એક જુનિયર વકીલની દલીલોથી પ્રભાવિત થઈને ન્યાયમૂર્તિએ તેને કોફી પીવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેની સાથે હાઈકોર્ટમાં આવેલા મિઢી કાફેમાં સામાન્ય વ્યક્તિની જેમ કોફીની મજા માણી હતી.

જુનિયર એડવોકેટ દ્વારા કરવામાં આવેલા દલીલ થી પ્રભાવિત થઈને જસ્ટિસ એએસ સુપેહીયા દ્વારા આ પ્રમાણે જુનિયર એડવોકેટને પ્રેરણા બળ પુરું પાડ્યુ હતું.

સમગ્ર ઘટનાની વિગતો મુજબ જસ્ટિસ એ એસ સુપેહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠ સમક્ષ એડવોકેટ દેવર્ષિ રાવલ તેમના સિનિયર બીજી મીટરમાં વ્યસ્ત હોવાથી સમય ફાળવવા ની માગણી સાથે આવ્યા હતાં.

પરંતુ ન્યાયમૂર્તિ જસ્ટિસ સુપેહીયા

દ્વારા આ શક્ય નહીં હોવાથી મેટર ચલાવવા માટે કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે જો તમે મેટર સારી રીતે ચલાવશો તો આજે જ આદેશ પસાર કરશે અને તેઓની સાથે રીસેસ માં કોફી પીશે. ત્યારબાદ મેટર થોડા સમય ચાલી હતી અને ન્યાયમૂર્તિ જુનિયર વકીલને કેટલાક સવાલો કયાં હતાં.

જેના જવાબો તેને આપ્યા હતા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ નું એક જજમેન્ટ પણ રજૂ કર્યું હતું, આથી આ દલીલોથી પ્રભાવિત થઈને ન્યાયમૂર્તિ એ તેને બપોરે

2.15 મિનિટે હાઈકોર્ટના પરિસરમાં આવેલા મિઢી કાફેમાં તેના મિત્રો સાથે કોફી પીવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ જસ્ટિસ સુપેહીયા ખુદ ચાલીને આવ્યા હતા.

વકીલો સાથે કોફી ની મજા માણી હતી. તેઓએ વકીલોને દલીલો કરવા અને વ્યવસાયમાં સફળતા માટે ટીપ્સ પણ આપી હતી. આ બાબતની હાઈકોર્ટમાં ખૂબ પ્રેરણાત્મક રીતે ચર્ચા થઈ હતી. પરીક્ષા પર દિલ્હી સ્થિત કન્ટ્રોલ કદાચ આવી ઘટના પ્રથમ વખત બની હતી.

હાઈકોર્ટમાં ‘વિરલ’ ઘટના: જુનિયર વકિલની દલીલથી પ્રભાવિત જજે તેમને કોફી પીવા આમંત્રણ આપ્યુ

સામાન્ય વ્યક્તિની જેમ કાફેમાં કોફી પીધી

અમદાવાદ તા.14 ગુજરાત હાઈકોર્ટ ખાતે આજે એક વિરલ ઘટના બની હતી જેમાં એક જુનિયર વકીલની દલીલોથી પ્રભાવિત થઈને ન્યાયમૂર્તિએ તેને કોફી પીવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેની સાથે હાઈકોર્ટમાં આવેલા મિઢી કાફેમાં સામાન્ય વ્યક્તિની જેમ કોફીની મજા માણી હતી.

જુનિયર એડવોકેટ દ્વારા કરવામાં આવેલા દલીલ થી પ્રભાવિત થઈને જસ્ટિસ એએસ સુપેહીયા દ્વારા આ પ્રમાણે જુનિયર એડવોકેટને પ્રેરણા બળ પુરું પાડ્યુ હતું.

સમગ્ર ઘટનાની વિગતો મુજબ જસ્ટિસ એ એસ સુપેહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠ સમક્ષ એડવોકેટ દેવર્ષિ રાવલ તેમના સિનિયર બીજી મીટરમાં વ્યસ્ત હોવાથી સમય ફાળવવા ની માગણી સાથે આવ્યા હતાં.

પરંતુ ન્યાયમૂર્તિ જસ્ટિસ સુપેહીયા

વંથલીની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો

ગુનો દાખલ થતાં મુંબઇ-સુરત તરફ

નાસી ગયો હતો :

જેલહવાલે

જુનાગઢ, તા. 14 વંથલીના સગીરા પર દુષ્કર્મ આચરી મુંબઈ ભાગેલો જુનાગઢનો શપ્સ ધરપકડ કરી આરોપીને સાથે રાખી પંચનામુ કર્યુ હતું. જુનાગઢના દોલતપરાના કીરીટનગરમાં રહેતો સાહિલ ગુલામઠદ રાહોડ સોસયલ મીડિયાથી વર્ષ 2022ના જુનમાં વંથલી વિસ્તારની સગીરા સાથે સંપર્કમાં આવેલ લગ્ન કરવાનું વચન આપી આ શપ્સે જુનાગઢ વિલીંગ્ડન ડેમ ખાતે ફરવા લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ દોલતપરા ખાતે રહેતો મિત્રના ઘરે અને રાજકોટની હોટલમાં લઈ જઈ

દુષ્કર્મ કરેલ ઉપરાંત તરૂણીના ભાઈને ધમકી આપી હોવાની ફરિયાદ 19 જાન્યુઆરીએ વંથલી પોલીસમાં નોંધાઈ હતી.

જેના પગલે ઈન્યાર્જ ના.પો. અધિકારી હિતેષ ધાંધલ્યાએ બે ટીમો મારફત તપાસ હાથ ધરી મુંબઈ ભાગેલો આરોપી સુરત થઈ મંગળવારના વંથલી આવતા આરોપીને દબોચી લીધો હતો. ગઈકાલે તેના દોલતપરા રહેતા મિત્રના ઘરે લઈ જઈ પંચનામુ કર્યુ હતું.પુછપરછમાં તેમની સામે ગુન્હો નોંધાતા તે ભાગી ગયો હતો તે વંથલીથી મુંબઈ પહોંચી ગયો હતો. ત્યાં બે દિવસ રખાયા બાદ સુરત આવી 10-12 દિવસ રોકાયા બાદ વંથલી આવ્યાની કબુલાત આપી હતી.

જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સ્પો-2025 નો શુભારંભ

જામનગર તા.14 રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મસ્ત્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સપો 2025 નો શુભારંભ કરાયો હતો. આ એક્સપોમાં વિવિધ 22 દેશોના પ્રતિનિધિશ્રીઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા હતા.અને 200 જેટલા સ્ટોલ્સના માધ્યમથી નવીનત્મક ટેકનોલોજીનું આદ્યોજિત કરવામાં આવેલ આ એક્સપો ઉદ્યોગકારોને ખરા અર્થમાં ઉપયોગી નીવડશે. ગુજરાતના ઉદ્યોગોને વિકાસની નવી દિશા મળે તે હેતુથી તટકાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાર્ષિક સમિટનો પ્રારંભ કરાયો હતો જેના પરિણામે આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર દેશમાં નંબર વન બન્યુ



ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રીમ રાજ્ય બન્યું છે. વાર્ષિક ગુજરાતમાં જિલ્લા કક્ષાએ પણ આયોજન કરી સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થાય તે પ્રકારનું મહત્વપૂર્ણ આયોજન પણ સરકારે હાથ ધર્યું છે.તાજેતરના બજેટમાં પણ સરકારે ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં સૌને ફાયદો થાય તે પ્રકારની જોગવાઈઓ કરી વિકસિત ભારતની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે.અને સરકારની આ નીતિઓના કારણે જ ચાર સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપવા જઈ રહેલું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બનશે.ઉદ્યોગો એ વિકાસના કેન્દ્રસ્થાને હોય છે ત્યારે આ ઉદ્યોગો સુરક્ષિત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ પગલાં ભરી રહી છે.ગુજરાતીઓની સાહસિકતા, પરિશ્રમ અને સરકારની નીતિઓના પરિણામે આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર દેશમાં નંબર વન બન્યુ

છે.આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતા સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું કે ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સપોના માધ્યમથી ટેકનોલોજી તથા વિચારોની આપ-લે થશે જેના પરિણામે જામનગરના બ્રાસ ઉદ્યોગને ખૂબ ફાયદો થશે. બ્રાસ ઉદ્યોગમાં આગળ વધવાની ખૂબ જ ક્ષમતા છે ત્યારે આ ઉદ્યોગના વિકાસ માટે સરકાર ઉદ્યોગકારો સાથે ખબેખબો મિલાવી કામ કરી રહી છે.વડાપ્રધાનશ્રી તથા નાણામંત્રીશ્રી ખૂબ જ સકારાત્મકતાથી જામનગરના ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે તમામ પ્રશ્નોની ઉકેલ લાવી રહ્યા છે.ઈમ્પોર્ટ ડૂબી સહિતના સેસા નાબૂદ કરી કેન્દ્ર સરકાર ઉદ્યોગકારોની પડખે ઊભી રહી છે અને નિયમોમાં જરૂરી ફેરફારો કરી જામનગરના ઉદ્યોગોને મદદરૂપ થઈ રહી છે.લઘુ ઉદ્યોગો એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજીુ સમાન

છે જેના માધ્યમથી સમગ્ર દેશમાં 25 થી 30 કરોડ લોકો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનશ્રી જામનગર, રાજકોટ અને મોરબીને વધુ પ્રાધાન્ય મળે તે પ્રકારના નિર્ણયો લઈ આ લઘુ ઉદ્યોગોને વિકસિત કરવામાં સતત પ્રયાસરત છે.ધારાસભ્ય શ્રી દિયેશભાઈ અકબરીએ આ પ્રસંગે જણાવ્યું કે ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સપો જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જશે.રાજ્ય તથા કેન્દ્રની સરકારો ઉદ્યોગોના વિકાસ માટે તત્પર છે અને ઉદ્યોગોનો વિકાસ હરણફાળ ભરે તે માટે તમામ પ્રશ્નો અને રજૂઆતોને ધ્યાને લઈ તેનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છે.એક્સપો વિશે વિગતો આપતા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી લાખાભાઈ કેશવાલાએ જણાવ્યું હતું કે આ સંસ્થાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે જામનગરના નાના બ્રાસ ઉદ્યોગકારોને આજના સ્પર્ધાત્મક તથા હરીફાઈયુક્ત વાતાવરણમાં વૈશ્વિક વ્યાપાર કરવાની તકો ધરઆંગણે જ મળી રહે તે આશયથી જામનગર ખાતે તા.13 થી 16 ફેબ્રુઆરી દરમ્યાન ‘જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સ્પો-2025’ નું આયોજન હાથ ધરાયેલ છે.

TIAAN CONSUMER LIMITED				
CIN: L85100GJ1992PLC017937				
Regd Office: 405, Patel Ahwamegh Complex, Jetalpur Road, Near Dairy Den Circle, Sayajigunj, Vadodara, Gujarat- 390005				
Corp Office: J-71, Lower Ground Floor, J- Block, Paryavaran Complex, IGNOU Road, Neb Sarai, New Delhi-110062				
Email: tiaanconsumerltd112@gmail.com, Contact No.: +91-8294697644				
Unaudited Financial Result for the quarter and nine months year ended on 31st December 2024				
S.N	Particulars	Quarter Ended		Nine Months Ended
		CURRENT QUARTER	CORRESPONDING QUARTER	CURRENT NINE MONTHS
		01.10.2024 to 31.12.2024 (₹)	01.10.2023 to 31.12.2023 (₹)	01.04.2024 to 31.12.2024 (₹)
		Unaudited	Unaudited	Unaudited
1	Total Income from operations	27.848	-	28.586
2	Net Profit / Loss for the period before tax and exceptional items	5.439	-	3.948
3	Net Profit/ Loss for the period before tax (after exceptional items)	5.439	-	3.948
4	Net Profit/ Loss for the period after tax (after exceptional items)	5.439	-	3.948
5	Total Comprehensive income/ loss for the period [comprising profit/ loss for the period (after tax) and other comprehensive income/ loss (after tax)]	5.439	-	3.948
6	Paid up equity share capital	1,026.900	-	1,026.900
7	Reserve (excluding revaluation reserve) as shown in the balance sheet for previous year	-	-	-
8	Earning per share (of Rs. 10/- each) Basic & Diluted	0.053	#DIV/0!	0.038
Note 1. The above is an extract of the detailed format of quarterly and Nine month year end financial results filed with the stock exchange under regulation 33 of the SEBI (Listing obligations and disclosure requirements) Regulations 2015.				
2.The above is an extract of the detailed format of quarterly financial result filed with thestock exchange under Regulation 33 of the SEBI (Listing obligations and disclosure requirements) Regulations 2015.The full format of the quarterly financial result are available on the company's Website- www.tiaanstore.in				
For and on behalf of board of directors of TIAAN CONSUMER LIMITED				
AJAY KUMAR DIRECTOR DIN : 07015936				
Date : 14/02/2025 Place: New Delhi				

